



જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૦/૧૧/૨૦૧૮ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૨૦૦/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૪ કેસ કરી, ૩૯ વ્યક્તિઓને ઝડપી, ૫૬ લીટર દેશી દારૂ, ૭૧ ઇંગ્લીશ દારૂ અને ૦૧ સ્કુટર કબજે કર્યું હતું. તેમજ જુગારધારા હેઠળ ૦૪ કેસ કરી ૨૩ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૯,૩૬૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૨૨૦૧/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૫૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી-૯૩ મુજબ ૦૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઘરફોડ ચોરી :-

સમાચાર યાદી નં.૨૨૦૨/૧૮

વાડજ : મિતેશભાઈ મંગળદાસ રાવલ (રહે, શ્રીનાથદ્રાર સોસાયટી, રોનકપાર્ક પાસે, નવા વાડજ) એ વાડજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૦/૧૧/૧૮ ના કલાક ૩/૦૦ થી ૫/૦૦ સુધીના સમયગાળા દરમ્યાન પોતાના મકાન તેમજ બાજુની કૃષ્ણનગર સોસાયટીના મકાન નંબર ૨/૨ ના દરવાજાનું લોક તથા નકુચા તોડી, અજાણી વ્યક્તિ મકાનમાં પ્રવેશ કરી, સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૧,૯૦,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એચ.ડી.પુરોહિત ચલાવે છે.

વેજલપુર : રાજેશભાઈ નથુભાઈ મકવાણા (રહે.શાંતીનગર સોસાયટી, વિભાગ-૧, જૈન દેરાસરની બાજુમા, સોનલ સીનેમા રોડ, વેજલપુર) એ તા.૧૦/૧૧/૧૮ નારોજ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૫/૧૧/૧૮ સાંજના ૬/૩૦ થી તા.૧૦/૧૧/૧૮ ના કલાક ૬/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરના રસોડાની બારીની ગ્રીલ તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, તીજોરીમાથી સોના-ચાંદીના દાગીના, સેમસંગનો કેમેરો અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૩,૪૫,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આઇ.ડી.પટેલ ચલાવે છે.

સાબરમતી : ભાવેશભાઈ કાંતીભાઈ મિસ્ત્રી (રહે.આગમન ફ્લેટ સતાધાર પાર્ક-૦૨ ની સામે દુધીયાડેરી ચાર રસ્તાની બાજુમા ન્યુ રાણીપ સાબરમતી) એ તા.૧૦/૧૧/૧૮ નારોજ સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૭/૧૧/૧૮ સાંજના ૪/૩૦ થી ૬/૧૫ વાગ્યા દરમ્યાન પોતાના ઘરના મુખ્ય દરવાજાની ફેમ તોડી દરવાજો ખોલી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, કબાટના ડ્રોઅર માંથી સોનાના દાગીના કિંમત રૂપિયા ૧,૨૫,૦૦૦/- અને રોકડ રૂપિયા ૨૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૪૫,૦૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે.આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી બી.પી.મેઘલાતર ચલાવે છે.

શહેરકોટડા : દિનેશકુમાર ભવરલાલ જૈન (ઉ.વ.૪૧)(રહે.મારૂતી કોમ્પ્લેક્ષ આનંદ ચોક સામે ઇંટવાડા રોડ સરસપુર) એ શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૦/૧૧/૧૮ બપોરના ૧/૦૦ થી સાંજના ૪/૩૦ વાગ્યા દરમ્યાન પોતાના ઘરના મુખ્ય દરવાજાનું તાળુ તોડી, અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી, ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા ૧૨,૦૦૦/- મળી કુલ રૂપિયા ૨,૭૬,૮૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.વી.ઘોકડીયા ચલાવે છે.

સોનાનો દોરો ખેંચી તોડી લઈ ગયા :-

સમાચાર યાદી નં.૨૨૦૩/૧૮

કાલુપુર : મીનાબહેન વા/ઓ ગોવીંદકુમાર લાલા (ઉ.વ.૬૨)(રહે.વિજયાપાર્ક સોસાયટી ગોરના કુવા પાસે મણીનગર પુર્વ) એ કાલુપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૦/૧૧/૧૮ રાતના ૧૦/૦૦ વાગ્યાના સુમારે રેવડી બજાર કોટની રાંગ સાઇદુર્ગા કિચેશન નામની દુકાન આગળ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા દરમ્યાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરુષ (૨૫ થી ૩૦ વર્ષના આશરાના) મેનાબહેનના ગળામાંથી સોનાનો દોરો કિંમત રૂપિયા ૯૦,૦૦૦/- મતાનો ખેંચી તોડી લઈ નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એન.બી.સોલંકી ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૨૨૦૪/૧૮

નરોડા : કેશુપરી ગુલાબપરી ગોસ્વામી (રહે.“જય સોમનાથ”-૪, રાધાપાર્ક સોસાયટી, શનીદેવ રોડ, મહુવા, જી.ભાવનગર) એ તા.૧૦/૧૧/૧૮ નારોજ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૮/૧૧/૧૮ સવાર ના ૪/૩૦ થી ૪/૪૫ વાગ્યા દરમ્યાન કૃષ્ણનગર એસ.ટી.બસ સ્ટેન્ડ ખાતે મહુવા એસ.ટી.બસ નંબર જીજે-૧૮-૧૦૮૮ માં એક અજાણ્યો છોકરો (૨૦ થી ૨૨ વર્ષના આશરાનો) બસના ડ્રાઇવર સાઇડનો દરવાજો ખોલી, ડ્રાઇવર સીટ નીચે મુકેલ થેલો કે જેમાં સોનાનું ૧૦૦ ગ્રામનું બિસ્કીટ તથા સોનાની ચેઇન નંગ-૨ મળી કુલ રૂપિયા ૩,૭૭,૨૫૦/- ની મતા મુકેલ હતી તે ચોરી કરી લઈ ગયો હતો. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.કે.મોરી ચલાવે છે.

વાહન અકસ્માતમાં મૃત્યુ :-

સમાચાર યાદી નં.૨૨૦૫/૧૮

એલીસબ્રીજ : સંજયભાઈ લોકેશભાઈ વિસક્રુટે (ઉ.વ.૪૪)(રહે.સબીતપુર, નંદપુર પ્રતાપપુર મહારાષ્ટ્ર) તા.૧૦/૧૧/૧૮ ના કલાક ૫/૦૦ વાગ્યાના સુમારે વા.સા.હોસ્પીટલ સામે ગોકુલ ડેરી ની સામે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા દરમ્યાન અજાણ્યા એક્ટીવા ચાલક (જેનુ નામ-ઠામ કે નંબર જાણવા મળેલ નથી) પોતાના કબજાની એક્ટીવા પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી, આ ની કીટલીમાં ઉપર કામ કરતા સંજયભાઈને ટક્કર મારતા, માથાના ભાગે ગંભીર ઇજા થતા, સારવાર અર્થે તેમને વા.સા.હોસ્પીટલ લઈ જતાં ફરજ પરના ડો.શ્રી એ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગેની ફરીયાદ શાન્તિલાલ નાનુભાઈ દલવાડી (રહે.નયનધારા ફ્લેટ રાજનગર ચાર રસ્તા, પાલડી એલીસબ્રીજ) એ એલીસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એ.ડી.પરમાર ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૨૨૦૬/૧૮

જીઆઈડીસી વટવા : અજયભાઈ વિલાસભાઈ કોકણે (ઉ.વ.૨૬) (રહે.પ્લોટ નંબર-૨૪ વિકલનગરનો ટેકરો જશોદાનગર) એ કોઈ અગમ્ય કારણસર તા.૦૯/૧૧/૧૮ સાંજના ૫/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે જી.આઈ.ડી.સી.વટવા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી સી.એમ.રાઠોડ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.